

RAN-2108002203050011

Third Year B. Com (External) Examination March - 2026

Advance Accounting and Auditing - III

Time: 3 Hours]

[Total Marks: 100

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book. (2) જમણી બાજુના અંક પ્રશ્નનાં ગુણ દર્શાવે છે. The right-hand issue shows the marks of the question (3) દરેક પ્રશ્નનો મુદ્દાસર અને સ્પષ્ટ જવાબ આપો. Give a clear and clear answer to each question.	Seat No.: <table border="1" style="width: 100%;"> <tr> <td style="width: 20px; height: 20px;"></td> <td style="width: 20px; height: 20px;"></td> <td style="width: 20px; height: 20px;"></td> <td style="width: 20px; height: 20px;"></td> <td style="width: 20px; height: 20px;"></td> <td style="width: 20px; height: 20px;"></td> </tr> </table> Student's Signature						

- પ્રશ્ન 1. ટૂંકમાં જવાબ આપો.** 20
1. ભારતમાં પ્રાચીન ઓડિટિંગના કોઈ પણ બે હેતુઓ જણાવો?
 2. આંતરીક નિયંત્રણની વ્યાખ્યા આપો.
 3. વાઉચરનો નમૂનો દોરી તૈયાર કરો.
 4. ઓડિટના પ્રકારો જણાવો.
 5. કરવેરા ઓડિટરના અસીલો જણાવો.
 6. ઓડિટ પ્રમાણપત્રનો અર્થ આપો.
 7. કરવેરા ઓડિટના હેતુ જણાવો.
 8. ઓડિટ નોંધપોથીના ફાયદા લખો.
 9. વહેંચણીપાત્ર નફાનો અર્થ આપો.
 10. કમ્પ્યુટર ઈનપૂટની માહિતી લખો.
- પ્રશ્ન 2.(અ) કાચા સરવૈયાને અસર કરતી ભૂલો સમજાવો.** 08
- (બ) કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો સમજાવો.** 08
- અથવા**
- પ્રશ્ન 2.(અ) પ્રાચીન ઓડિટિંગની તકનીકો (પદ્ધતિઓ) સમજાવો.** 08
- (બ) પ્રાચીન ઓડિટિંગના મહત્વ સમજાવો.** 08
- પ્રશ્ન 3.(અ) ઓડિટિંગનો અર્થ આપી તેનાં ફાયદા, મર્યાદા જણાવો.** 08
- (બ) આદર્શ આંતરિક અંકુશની પદ્ધતિનાં લક્ષણો જણાવો.** 08
- અથવા**
- પ્રશ્ન 3.(અ) નવું ઓડિટ શરૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ સમજાવો.** 08
- (બ) મજૂરીની ચૂકવણી અંગે આંતરીક અંકુશ પદ્ધતિ જણાવો.** 08
- પ્રશ્ન 4.(અ) દર્દીનાં સબંધીઓ માટે રહેઠાણ અને અન્નક્ષેત્ર ચલાવતા ધર્માદા ટ્રસ્ટનો ઓડિટ કાર્યક્રમ તૈયાર કરો.** 08
- (બ) દગો કે છોતરપિંડીની શંકા હોય ત્યારે અન્વેષણ કેવી રીતે કરશો?** 08
- અથવા**

પ્રશ્ન 4.(અ) વાઉચિંગ વ્યાખ્યા લખી તેનું મહત્વ સમજાવો અને નીચેનાનું વાઉચિંગ કરો.	08
1. મળેલું ભાડું	2. શેરમૂડી
(બ) નીચેનાની ચકાસણી કેવી રીતે કરશો.	08
1. પાઘડી	2. પેટા રોકડ
પ્રશ્ન 5.(અ) ટૂંકનોંધ લખો (ગમે તે બે)	16
1. ઓડિટ ટ્રેઈલ્સના ફાયદા જણાવો.	
2. કંપનીધારો 2013 અનુસાર ડિવિડન્ડ અંગેની જોગવાઈઓ	
3. કરવેરા ઓડિટ અંગેની કલમ 44 AB	
4. ઓડિટરના કામકાજના કાગળો અને આ કાગળોનું મહત્વ સમજાવો.	
પ્રશ્ન 6. તફાવત સમજાવો. (ગમે તે બે)	16
1. નફો અને વહેંચણીપાત્ર નફો સમજાવો.	
2. આંતરીક ઓડિટ અને ઊંડાણપૂર્વકનું ઓડિટ.	
3. નિત્ય તપાસ અને પ્રાયોગિક તપાસ વચ્ચેનો તફાવત.	
4. ઓડિટ પ્રમાણપત્ર અને ઓડિટ અહેવાલ.	

ENGLISH VERSION

Q. 1. Answer in brief:	20
1. Give any two purposes of ancient auditing in India.	
2. Define internal control ?	
3. Draw a specimen of a voucher.	
4. Explain types of Audit	
5. Who are the clients of a tax auditor ?	
6. Explain meaning of Audit certificate.	
7. State the objectives of tax audit.	
8. Give the advantages of audit note book?	
9. Explain meaning of divisible profit.	
10. Explain briefly input unit of a computer.	
Q. 2. (A) State errors affecting the trial Balance.	08
(B) State errors not affecting the trial Balance.	08
OR	
Q. 2. (A) Explain the techniques of ancient auditing.	08
(B) Explain importance of ancient auditing.	08
Q. 3. (A) What do you mean by Auditing? State the advantages and disadvantages of Audit.	08
(B) State characteristics of an Ideal Internal control system.	08
OR	
Q. 3. (A) Explain the points to be kept in mind at the commencement of a new audit.	08
(B) Explain the internal check system for payment of wages.	08
Q. 4. (A) Prepare Audit program of charitable trust conducting activities of providing residence and food to the relatives of patients.	08
(B) Explain investigation procedure of an auditor in the case of fraud and misappropriation.	08

OR

- | | | |
|------------------|---|------------------|
| Q. 4. (A) | Define vouching and explain its importance. Explain vouching of: | 08 |
| | a. Rent received | b. Share Capital |
| (B) | How will you verify the following ? | 08 |
| | 1. Goodwill | 2. Petty Cash |
| Q. 5. | Write short notes. (any Two) | 16 |
| | 1. Advantages of Audit trail. | |
| | 2. State the provision of Dividend as per provisions of Companies Act-2013. | |
| | 3. Section 44AB | |
| | 4. What are Auditor's working papers? Explain significance of these papers. | |
| Q. 6. | Explain differences between (any two) | 16 |
| | 1. Explain Profit and Divisible profit | |
| | 2. Explain Internal Audit and Audit in Depth | |
| | 3. Difference between Routine checking and Test checking. | |
| | 4. Difference between Audit Report and Audit Certificate. | |